

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા GST Amnesty Scheme અંતર્ગત પડતી મુશ્કેલીઓ અંગે CGST ચીફ કમિશ્નર સમક્ષ સુચનો રજુ કરવામાં આવેલ....

સરકારશ્રી GST અંતર્ગત દ્વારા કરદાતાઓને દંડ અને વ્યાજના બોજ વગર તેમના પાલનના મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ GST Amnesty Scheme અંતર્ગત પડી રહેલ મુશ્કેલીઓ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા CGST પ્રિન્સીપાલ ચીફ કમિશ્નરશ્રીમતી બી.વી. શિવાનાગા કુમારી મેડમ તથા રાજકોટ CGST પ્રિન્સીપાલ કમિશ્નરશ્રી શિવાકુમાર વી. સાહેબને નીચે મુજબના પ્રશ્નો-સુચનો રજુ કરવામાં આવેલ.

(૧) ડિપાર્ટમેન્ટ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ શો-કોઝ નોટીસ બહુવર્ષિય હોવાને કારણે આ પ્રકારની શો-કોઝ નોટીસ પ્રમાણે ઇશ્યુ કરવામાં આવેલ છે. બહુવર્ષિય મુદ્દે ઇશ્યુ કરાયેલ નોટીસ સંયુક્તરૂપમાં મોકલવામાં આવે છે. આ સંજોગોમાં જો કોઈ કરદાતા કોઈ નિશ્ચિત વર્ષ માટે યોજનાનો લાભ લેવા માંગે તો તેમને તમામ વર્ષોના ટેક્સનું ચુકવણું કરવું પડે છે. જેને કારણે તેઓ ઉપર અસહ્ય નાણાકીય બોજો પડે છે. તેથી કરદાતા નિશ્ચિત વર્ષ માટે યોજનાનો લાભ મેળવી શકે તેવી જોગવાઈ કરવી.

(૨) ઉપરોક્ત કારણોસર કરદાતાને મળવાપાત્ર થતા લાભ ગુમાવવા પડે છે. આ સંજોગોમાં મુદાસર અલગ-અલગ ઓપ્શન આપવા જોઈએ.

(૩) આ સ્કિમમાં એવા કરદાતાઓને રિફંડના લાભો મળવાપાત્ર નથી જેમણે CGST એક્ટ-૨૦૧૭ ના સેક્શન-૭૩ અંતર્ગત વ્યાજ અને દંડ સાથેની કર જવાબદારી પહેલાથી જ ચુકવી દીધેલ છે. જે અયોગ્ય છે. કારણ કે GST જોગવાઈઓનું વહેલું પાલન કરનારા પ્રમાણિક કરદાતાઓ દંડતા અનુભવે છે અને જે કરદાતા અપિલ કે નિર્ણયની રાહ જઈ રહ્યા હોય તેમને આ યોજનાનો લાભ મળવાની તક મળે છે. તેથી કરદાતાઓમાં સમાનતા અને ન્યાયીતા જાળવવા માટે ઓછામાં ઓછા કર ચુકવણી પર વસુલવામાં આવતી વ્યાજની રકમનું રીફંડ પુરૂ પાડવામાં આવે અને આવી જોગવાઈ રદ કરવી.

(૪) કાયદાના સેક્શન-૫૦ હેઠળ Amnesty Scheme ના લાભાર્થી પાસેથી વિલંબીત ચુકવણી ચાર્જનું વ્યાજ વસુલવા માટે નોટીસ આપવામાં આવે છે. Amnesty Scheme માં આ બાબતનો ઉલ્લેખ ન હોવાને કારણે કરદાતાને વિલંબીત ચુકવણી વ્યાજનારૂપમાં વધારાનો આર્થિક બોજ સહન કરવો પડે છે. તો આ અંગે યોગ્ય નિરાકરણ લાવવું.

(૫) CGST/SGST Act-2017 ના સેક્શન-૭૪ અંતર્ગત GST ડિપાર્ટમેન્ટ દ્વારા Amnesty Scheme ના



RAJKOT CHAMBER OF COMMERCE & INDUSTRY

લાભાર્થીને તેઓએ પુરી પાડવા યોગ્ય માહિતી તથા હકિકતોને નજર અંદાજ કરી અને સદર લાભ મેળવવા માટે અરજી કરી છે તેમ માની શો-કોઝ નોટીસ ઇશ્યું કરેલ છે.

હકિકતે સેક્શન-૭૪ના સ્પષ્ટીકરણ નંબર-૨ મુજબ સપ્રેશનના સ્પષ્ટ અર્થ મુજબ કર ચુકવવાપાત્ર વ્યક્તિએ જરૂરી માહિતીઓ, સ્ટેટમેન્ટ, રીપોર્ટ કે કોઈ પ્રકારના જરૂરી ડોક્યુમેન્ટ અને માંગલ માહિતી રજૂ કરેલ ન હોય તેવા કિસ્સામાં સપ્રેશન શબ્દ લાગુ પડે છે. GST એક પોર્ટલ બેઈઝ કરમાળખું છે અને તંત્ર દ્વારા સેક્શન-૭૩ અને ૭૪ અંતર્ગત ઇશ્યું કરાયેલ નોટીસોના કિસ્સામાં GST પોર્ટલ ઉપર તમામ હકિકતો ઉપલબ્ધ હોવાને કારણે સપ્રેશનનો આક્ષોપ અન્યાયકારી જણાય છે. તદઉપરાંત ગુજરાત રાજ્યમાં સેક્શન-૭૪ હેઠળ ઇશ્યું કરવામાં આવેલ નોટીસો આજદીન સુધીમાં અનિર્ણિત હોવાના કારણે કરદાતાઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ GST પોર્ટલ ઉપર કરદાતાની તમામ વિગતો હોવાના કારણે સપ્રેશન સલંગન યોગ્ય નિરાકરણ લાવવું.

આમ ઉપરોક્ત પ્રશ્નો-સુચનોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે CGST ડિપાર્ટમેન્ટ દ્વારા દિલ્હી ખાતે GST કાઉન્સિલને પણ રજુઆત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

